

"SUDARSHAN"

Weekly E-bulletin of Rotary club of Surat

24th December 21-22

Rotary
club of Surat



SERVE TO CHANGE LIVES

Issue -21

R.I. President
Shekhar Mehta

District Governor
Santosh Pradhan

President
Bhishma Jariwala

Hon. Secretary
Nikhil Madrasi

Editor
R'ann Manjari Desai

We meet every Friday
Dr. Sarosh Bhacca Memorial Rotary Hall,
Jeevan Bharti School Annexe, Timaliawad,
Nanpura, Surat - 395001
For Private Circulaion only

“ટ્રેઝર હન્ટ” એટલે આનંદનો ટ્રેઝર

તારીખ ૧૯.૧૨. ૨૦૨૧ ને રવિવારે રોટરી ક્લબ સુરતે એક તન અને મનની કસરત મજા લેતા લેતા કરાવી. નીખિલભાઈ મદ્રાસી અને મંથન મદ્રાસી દ્વારા એક અનોખી ગેમ નું આયોજન થયું. એ ગેમ હતી “ટ્રેઝર હન્ટ” - ખજાનાની શોધ.

સુરતના ખજાના સમાન વિવિધ સ્થળોનું ખૂબ જ અલંકારિક ભાષા માં વર્ણન, શબ્દોના આટાપાટા એ આ રમતની ખૂબી હતી અને રમતનું એ જ હૃદય પણ હતું. ખુબ જ સરસ રીતે નિખિલભાઈ દ્વારા સુરતના સ્થળોનું વર્ણન - ઘટનાઓનું વર્ણન - વાહ ! વાહ ! આ વર્ણન વાળી પ્રશ્નોત્તરી સાથે સ્પર્ધકો બરાબર દસ વાગ્યે જીવનભારતી પોતાનો રસ્તો ખુંદવા નીકળ્યા. રસ્તામાં જાતજાતના અનુભવોનો ખજાનો લૂંટાવ્યો જેમ કે એક ટીમ તાત્કાલિક પાંદડા અને દાંડીથી ભેગી કરીને હાર બનાવ્યો, જેકેટ ની ખરીદી કરવા નીકળ્યા હોઈ પ્પણ ખરીદી નથી કરવાની ને ફોટો પડાવ્યા વગેરે વગેરે ઘણું. કારની રેસમાં ભાગ લીધો હોય તેમ દોડ્યા. જાતજાતનું કર્યું સાથે જ ન ભાગ લેનારાને પસ્તાવાનો વારો આવ્યો. બપોરે એક વાગ્યે બધી ટીમ પાછી આવી ગઈ. બધાએ સમયસર મંથન અને નિખિલભાઈ ને ફોટા પોસ્ટ કરવાના ટાસ્કનો ખાસ જ હતું. પાછા ફરીને મૂલ્યાંકન થયું. સ્પર્ધકોમાંથી કોણ જીત્યું તે જાહેર થયો સર્વે પોતાના અભિપ્રાયો બનાવ્યા એમાં ખૂબ જ મજા આવી. પછી પરોઠા દહીં પુલાવ સાથે ભુપેન્દ્રભાઈ અને રૂપેશભાઈએ બધાને તૃપ્ત કર્યા. તો ચાલો જાણીએ વિજેતા ટીમના નામ :



પ્રથમ વિજેતા

મુણાલ કોઠારી
કિંજલ કોઠારી
દેવમ મુણાલ કોઠારી
લીના શાહ
હેમંત ઠક્કર

દ્વિતીય વિજેતા

જિલ્પા શેઠ
આનંદ શેઠ
રાજેશભાઈ ભટ્ટ
દેવયાનીબેન ભટ્ટ

તૃતીય વિજેતા

વિનીત પંચાલ
દીપ્તિ નાણાવટી
રૂપલ ભટ્ટ
નિમિષ મહેતા



શિયાળાની ઠંડીમાં રોટરીની હૂંફ

સ્વેટર વિતરણ

આ પ્રોજેક્ટ ની કમાલ એ છે કે નાનકડા ભૂલકાઓને કડકડતી ઠંડીમાં સુંદર સુંદર હૂંફાળું લાલ રંગનું સ્વેટર પહેરાવી હૂંફ આપવાની.



કિસી કી મુસ્કરાહટોં પે હો નિશાન,
કિસીકા દઈ લે શકે તો લે ઉધાર,
જીના ઉસીકા નામ હૈ !

શિયાળાની કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા બાળકોનું દઈ સમજી રોટરી ક્લબ સુરત એ સ્વેટર બનાવી વહેંચવાનું ખૂબ જ ઉમદા કાર્ય હાથ ધર્યું છે. એક ખૂબ મોટો પડાવ ગામડાની શાળામાં લગભગ ૧૦૦૦થી વધુ સ્વેટર વહેંચવાનો પાર પાડ્યો અને હવે સણીયા કણદે ની પ્રાઈમરી શાળા માં વધુ ૬૦ જેટલા સ્વેટર વહેંચ્યા કે જેની કિંમત લગભગ બાર હજાર રૂપિયા થાય છે. લાલ સ્વેટર માં બાળકો ખૂબ જ શોભતા હતા. એક હૂંફ દ્વારા રાહતનો અનુભવ એમના સ્મિતમાં છલકાતો હતો. આ કાર્ય માટે પ્રેસિડેન્ટ ભીષ્માબેન જરીવાલા, પીડીજી હિતેશભાઈ જરીવાલા અને સેક્રેટરી નિખિલ મદ્રાસી હાજર રહ્યા હતા





PEACEBUILDING AND
CONFLICT PREVENTION



DISEASE PREVENTION
AND TREATMENT



WATER, SANITATION,
AND HYGIENE



MATERNAL AND
CHILD HEALTH



BASIC EDUCATION
AND LITERACY



COMMUNITY ECONOMIC
DEVELOPMENT



ENVIRONMENT



ભૂખ્યા ને ભોજન

સ્વામી વિવેકાનંદે પરિભ્રમણ કરી ભારત દર્શન કર્યું ત્યારે તેમણે જોયું કે દેશમાં કેટલાય લોકોને પેટ પૂરતું ખાવાનું નથી મળતું. ભૂખ્યા પેટે કદી ભજન ન થાય. પરદેશ જઈ ને પૈસા ભેગા કરવાનો નિર્ણય કર્યો. દેશમાં આવીને દીન દુખિયા ના દુઃખ દૂર કરવાનું દિવ્ય કાર્ય કર્યું. એમની પ્રેરણા સ્વરૂપ રોટરી ક્લબ સુરત દર અઠવાડિયે ભૂખ્યાને ભોજન કરાવવાનું નક્કી કર્યું. આ દિવ્ય અને ભગીરથ કાર્ય હાથ ધરી અને આજે એ ખુબ જ સરસ રીતે અમલમાં આવી રહ્યું છે. તારીખ ૧૬.૧૨.૨૦૨૧ ને રોજ રોટેરીયન ઉમંગ દલાલ અને રોટરી પાર્ટનર નિકિતા દલાલે લગભગ સાઈઠ જેટલા લોકોને ભોજન પીરસી એમના મુખ પર સ્મિત રેલાવાનું ઉમદા કાર્ય કર્યું હતું. આ સાથે દક્ષાબેન શાહ અને કુંદનભાઈ શાહ પણ હાજર રહ્યા હતા



Interesting figures about Rotary Membership :

1. There are 36,994 clubs world-wide with 1,201,283 Rotarian's.
2. USA has 7,430 clubs with 286,312 Rotarian's.
3. In Our 4 Zones, we have 1,79,858 Rotarians in 4675 clubs.
4. India has 4,445 Rotary Clubs with 171,400 Rotarian's.
5. India has 14.92% women members, while we have 24.61% women worldwide.

Gender Distribution

Zone	Women %
IV	19.80%
V	10.30%
VI	16.60%
VII	13.92%
All 4 Zones	15.02%
World-wide	24.61%



Rahee Homkar : 26th December 2021
Jilpa Sheth : 27th December 2021
Manish Kapadia : 30th December 2021
Ekta Jariwala : 30th December 2021
Nayana Mehta : 30th December 2021



Munish & Trupti Modi : 25th December 2021